

July 08, 2021

To,
Corporate Relationship Department
BSE Limited
14th Floor, P. J. Towers,
Dalal Street, Fort,
Mumbai-400 001
SCRIP CODE: 532779

To,
Listing Department,
National Stock Exchange of India Limited
"Exchange Plaza", C – 1, Block G
Bandra- Kurla Complex, Bandra (East),
Mumbai 400 051
SYMBOL: TORNTPOWER

Dear Sir/ Madam,

Sub: News Paper Advertisement for public notice for 17th Annual General Meeting (AGM) of the Company through Video Conferencing / Other Audio-Visual Means (VC/ OAVM)

Pursuant to the Regulations 30 and 47 of SEBI (LODR) Regulations, 2015 read with circulars dated May 05, 2020 and January 13, 2021 issued by the Ministry of Corporate Affairs (MCA Circulars), we enclose herewith a copy of public notice published today in "The Financial Express" in English (All India Editions) and in "Jai Hind" in Gujarati (Ahmedabad Edition), having electronic editions, intimating the Members about the 17th AGM of the Company to be held on Friday, August 06, 2021 at 09.30 a.m. (IST) through VC / OAVM, Record Date for Dividend and other details as required by the MCA Circulars.

The above information is also available on Company's website at www.torrentpower.com.

This is for your information and record.

Thanking you,

Yours faithfully,

For Torrent Power Limited



Rahul Shah
Company Secretary & Compliance Officer
Encl: As above



KERALA WATER AUTHORITY e-Tender Notice

Tender No: UBSE/PHRC/2021-22
 STATE PLAN-2021-2022-Supplying and Commissioning of 2 Nos. of 1600 KVA Indoor Transformer, 1 No of 63 KVA Indoor transformer and 3 Nos. of Suitable HP pumps at 12m dia well cum pumphouse and allied works at Perour.
 • EMD : Rs. 2,00,000/- • Tender Fee : Rs. 10,000/- + 18% GST
 • Last Date for submitting Tender : 02.08.2021, 3pm • Phone : 0481-2562745
 Website : www.kwa.kerala.gov.in, www.etenders.kerala.gov.in

Superintending Engineer
 PH Circle, Kottayam
KWA-JB-GL-6-245-2021-22

NMDC Limited
 (A GOVERNMENT OF INDIA ENTERPRISE)
 NMDC Iron & Steel Plant, Post - Nagarnar (Bastar)
 C.G. PIN 494001

CONTRACTS DEPARTMENT

NMDC Limited, A "NAVARATNA" Public Sector Company under Ministry of Steel, Govt. of India, invites **Offline bids** from experienced domestic bidders for the followings tender enquiry with start and end date as below for 3.0 MTPA Integrated Steel Plant at Nagarnar, near Jagdalpur, Chhattisgarh state.

- Name of the work:** Outsourcing of Up-keeping of technological buildings in sinter plant premises. **Tender no & Date:** NISP/CONTRACTS/M&C/237/0&M-06/2020/225 Dated: 08.07.2021 | **Last date of submission:** 05.08.2021.
- Name of the work:** Outsourcing Mechanical Maintenance jobs of Sinter Machine Building, Sinter Cooler up to Sinter Transport Route in Sinter Plant. **Tender no & Date:** NISP/CONTRACTS/M&C/238/0&M-07/2020/226 Dated: 08.07.2021 | **Last date of submission:** 05.08.2021.
- Name of the work:** Outsourcing mechanical maintenance jobs of fans, proportioning bin's building, intensive mixing building and utilities, etc. **Tender no & Date:** NISP/CONTRACTS/M&C/239/0&M-08/2020/227 Dated: 08.07.2021 | **Last date of submission:** 05.08.2021.
- Name of the work:** Operation & Maintenance Hydraulic & Lubrication system of Blast Furnace. **Tender no & Date:** NISP/CONTRACTS/M&C/240/0&M-11/2020/228 Dated: 08.07.2021 | **Last date of submission:** 06.08.2021.
- Name of the work:** Operation & Maintenance work of Thin Slab Caster Mould & Segment Shop. **Tender no & Date:** NISP/CONTRACTS/M&C/241/0&M-28/2020/229 Dated: 08.07.2021 | **Last date of submission:** 06.08.2021.
- Name of the work:** Operation & Maintenance work of Water Treatment Plant of Thin Slab Caster, Tunnel Furnace & Hot Strip Mill. **Tender no & Date:** NISP/CONTRACTS/M&C/242/0&M-31/2020/230 Dated: 08.07.2021 | **Last date of submission:** 06.08.2021.
- Name of the work:** Outsourcing of Material Handling (Mechanical & Manual) works in stores. **Tender no & Date:** NISP/CONTRACTS/M&C/243/0&M-77/2020/231 Dated: 08.07.2021 | **Last date of submission:** 06.08.2021.

The detailed NIT and Bid documents can be viewed and / or downloaded from NMDC website <http://www.nmdc.co.in> and Central Public Procurement portal (CPP PORTAL) <http://www.eprocure.gov.in/epublish/app>.

The Bidders, on regular basis are required to visit the NMDC's website / CPP Portal websites for corrigendum, if any, at a future date.

For further clarification, please contact HD (Contracts) Email: nispmaterials@nmdc.co.in, srinivasp@nmdc.co.in; wskhw@nmdc.co.in **HD (Contracts)**

RBI slaps ₹14.5-cr penalty on SBI, BoB, 12 other banks

PRESS TRUST OF INDIA
 Mumbai, July 7



THE RESERVE BANK OF India (RBI) on Wednesday said it has imposed penalties on SBI, Bank of Baroda, IndusInd Bank, Bandhan Bank and 10 other lenders for contravention of various regulatory norms, including on lending to NBFCs. The penalty imposed on the 14 banks totals ₹14.5 crore, with a maximum ₹2-crore fine on Bank of Baroda. According to a release, ₹1-crore penalty has been imposed each on Bandhan

Bank, Bank of Maharashtra, Central Bank of India, Credit Suisse AG, Indian Bank, IndusInd Bank, Karnataka Bank, Karur Vysya Bank, Punjab and Sind Bank, South Indian Bank, The Jammu & Kashmir Bank, and Utkarsh

Small Finance Bank.

The penalty imposed on SBI is ₹50 lakh.

Giving details, the RBI said scrutiny in the accounts of the "companies of a Group" was carried out and it was observed that the banks had failed to comply with certain provisions.

Notices were issued to the banks, advising them to show cause as to why a penalty should not be imposed for non-compliance with the directions/contraventions of provisions of the Banking Regulation Act, 1949.

Equitas SFB's collection efficiency improves to 83.49% in June

FE BUREAU
 Chennai, July 7



EQUITAS SMALL FINANCE Bank (ESFB) on Wednesday said its collection efficiency had improved to 83.49% in June, up from 77.84% in May, but declining from the April figure of 105.16%. The billing efficiency of the bank has also inched up to 69.52% in June from 66.97% in the previous month, according to the provisional figures filed by the ESFB with the stock exchanges.

In April, the bank had clocked a billing efficiency of 84.68%. MD & CEO P N

Vasudevan said: "The first quarter of the year witnessed tepid repayments as most of the regions the bank operates in were under lockdown. The bank's borrowers are largely in the informal segments, dealing in daily use products and services which were temporarily disrupted due to the Covid-19 restrictions imposed. However, during the month of June

2021, states in the west and north experienced improved collection efficiencies as lockdowns eased while southern states opened up towards the end of the month. We anticipate a sharp improvement in collections in the coming months as Covid wave two recedes."

The bank's gross advances grew 15% YoY in the quarter ended June to ₹17,839 crore from ₹15,573 crore in the corresponding quarter of the last fiscal year. Sequentially, the bank's gross advances have remained flat compared to ₹17,925 crore in Q4FY21.

Torrent Power Limited
 Regd. Office: "Samanvay", 600 Tapovan, Ambawadi, Ahmedabad - 380015 (Gujarat), India
 Phone: +91 79 26628300
 Fax: +91 79 26764159

NOTICE OF 17TH ANNUAL GENERAL MEETING ("AGM")

Notice is hereby given that the 17th AGM of the Members of the Company will be held on Friday, August 06, 2021 at 9:30 am IST to transact the business as set out in the Notice of AGM, which will be circulated for convening of AGM, through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") in view of continuing COVID-19 pandemic, in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act"), the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("the Listing Regulations") and the Ministry of Corporate Affairs (MCA) circulars dated January 13, 2021 and May 05, 2020 read with circulars dated April 08 and April 13, 2020 (collectively referred as "the MCA Circulars"). Members can attend and participate in the AGM through VC/ OAVM facility only as per instructions provided in the Notice of AGM.

In compliance with the aforesaid MCA Circulars and SEBI Circular dated May 12, 2020 and January 15, 2021, the Notice of AGM along with Annual Report for FY 21, inter-alia, including remote e-voting instructions, will be sent only by electronic mode to those Members, whose email addresses are registered with the Company/ Depository participant (DP) and will be available on the websites of the Company: www.torrentpower.com, the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and Central Depository Services Limited ("CDSL") at www.evotingindia.com.

Pursuant to the provisions of section 108 of the Act read with the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of the Listing Regulations and the MCA Circulars, the Company will provide e-voting facility through CDSL to the Members holding shares in physical or dematerialized form, as on the **cut-off date i.e. Friday, July 30, 2021** to exercise their right to vote by electronic means on any or all of the business specified in the Notice of AGM. Detailed instructions for remote e-voting facility and e-voting during AGM are forming part of the Notice of AGM.

Members may note that the Board of Directors at its meeting held on May 20, 2021 has recommended final dividend of ₹ 5.50 per equity share. **The record date for the purpose of Dividend is Friday, June 25, 2021.** The final dividend, if declared at the AGM, the payment of such dividend will be made on or before September 03, 2021, subject to deduction of tax at source.

Members are encouraged to utilize Electronic Clearing System (ECS) for receiving dividends by registering their bank account details with the Company. For further information, the Members are requested to approach RTA of the Company i.e. Link Intime India Pvt. Ltd.

In case the Members have not registered their email addresses and bank account details with the Company/ DPs may follow the process detailed below for registration :

Physical Holding	By clicking on the below link, the Member may register his/ her email address, mobile number and bank details https://web.linkintime.co.in/EmailReg/Email_Register.html After clicking the above link, the Member has to fill relevant details in the respective fields and attach self attested copy of PAN, address proof/ share certificate and cancelled cheque leaf.
Demat Holding	By clicking on the below link, the Member may register his/ her email address and mobile number https://web.linkintime.co.in/EmailReg/Email_Register.html For registration of bank details, the Member need to go with their respective DPs.

In the event the Company is unable to pay the dividend to any Member by electronic mode due to non-registration of the Bank account, the Company will dispatch the dividend warrant / cheque to such Member in due course.

Pursuant to the Finance Act, 2020, dividend income is taxable in the hands of the Members w.e.f. April 01, 2020 and the Company is required to deduct tax at source from dividend paid to the Members at the prescribed rates. For the prescribed rates of Income Tax for various categories, please refer to the Finance Act, 2020 and amendments thereto.

Detailed instructions for the same are uploaded on website of the Company at <https://www.torrentpower.com/pdf/download/CommunicationtoShareholderTaxonFinalDividend.pdf> and website of the Stock Exchanges.

By order of the Board
For Torrent Power Limited
Rahul Shah
 Company Secretary

Place : Ahmedabad
 Date : July 07, 2021

GR Infraprojects IPO subscribed 2.28 times on Day 1

PRESS TRUST OF INDIA
 New Delhi, July 7

THE INITIAL PUBLIC offering of GR Infraprojects was subscribed 2.28 times on the first day of subscription on Wednesday. The IPO received bids for 1,85,21,058 shares against 81,23,594 shares on offer, according to NSE data.

The category meant for qualified institutional buyers (QIBs) was subscribed 49%, non-institutional investors 2.68 times and retail individual investors (RIIs) 3.25 times.

The IPO is in a price range of ₹828-837 per share. At the upper end of the price band, the issue will fetch ₹963.28 crore. The public issue being only an offer for sale, the company will not receive any proceeds from the offer.

GR Infraprojects on Tuesday said it has mobilised a little over ₹283 crore from anchor investors. Shares of the company are proposed to be listed on the BSE and NSE.

HDFC Bank, ICICI Securities, Kotak Mahindra Capital Company, Motilal Oswal Investment Advisors, SBI Capital Markets and Equirus Capital are the managers to the offer.

Clean Science issue subscribed 1.70 times on first day

THE INITIAL PUBLIC offering of speciality chemicals manufacturer Clean Science and Technology was subscribed 1.70 times on Wednesday, the first day of subscription. The public offer received bids for 2,09,47,200 shares against 1,23,02,672 shares on offer, according to data available with the NSE.

The portion for qualified institutional buyers (QIBs) was subscribed 1%, non-institutional investors 2.15 times and retail individual investors (RIIs) 2.48 times.

The ₹1,546.62-crore initial public offering (IPO) is entirely an offer for sale (OFS) by existing promoters and other shareholders. —PTI

CreditAccess Grameen
CREDITACCESS GRAMEEN LIMITED
 No. 49, 46th Cross, 8th Block, Jayanagar, Bengaluru - 560070
 Tel: +91 80 22637300; Fax: +91 80 26643433
 Email: cs@cagrameen.in; Website: www.creditaccessgrameen.in
 CIN: L51213KA1991PLC053423

NOTICE OF THE 30TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 30th Annual General Meeting (AGM) of the members of CreditAccess Grameen Limited (the "Company") will be held on Friday, July 30, 2021 at 3:00 p.m. IST through Video Conferencing / Other Audio-Visual Means ("VC"). In compliance with General Circular numbers 20/2020, 14/2020, 17/2020, 22/2020, 33/2020, 39/2020 and 10/2021 issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular number SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated May 12, 2020 and January 15, 2021, respectively, issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as "the Circulars"), Companies are allowed to hold AGMs through VC, without the physical presence of members at a common venue. Hence, the AGM of the Company is being held through VC to transact the business as set forth in the Notice of the AGM dated June 25, 2021.

In compliance with the Circulars, electronic copies of the Notice of the AGM and Annual Report for 2020-21 have been sent to all the members whose email IDs are registered with the Company/Depository Participants/Registrar & Share Transfer Agent. These documents are also available on the website of the Company at www.creditaccessgrameen.in, Stock Exchange websites www.bseindia.com and www.nseindia.com and on the website of KFin Technologies Private Limited, the Company's Registrar & Share Transfer Agents (RTA) at <https://evoting.karvy.com/>. The dispatch of Notice of the AGM through emails has been completed on July 07, 2021.

Members holding shares in dematerialized form, as on the cut-off date July 23, 2021, may cast their votes electronically on the business as set forth in the Notice of the AGM through the electronic voting system of RTA (remoting e-voting). Members are hereby informed that:

- The business as set forth in the Notice of the AGM may be transacted through remote e-voting or e-voting system at the AGM;
- The remote e-voting shall commence on Tuesday, July 27, 2021 (9:00 a.m. IST);
- The remote e-voting shall end on Thursday, July 29, 2021 (5:00 p.m. IST);
- The cut-off date for determining the eligibility to vote by remote e-voting or by e-voting system at the AGM shall be July 23, 2021;
- Remote e-voting module will be disabled after 5:00 p.m. IST on July 29, 2021;
- Any person, who acquires shares of the Company and becomes a member post-dispatch of the Notice of the AGM and holds shares as on the cut-off date may obtain the login ID and password by sending a request at inward.ris@kfintech.com. However, if a member is already registered with RTA for e-voting then the existing user ID and password can be used for casting their vote;
- Members may note that: a) once the votes on a resolution is cast by a member, the member shall not be allowed to change it subsequently; b) The facility for e-voting will also be made available during the AGM, and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the AGM. c) The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their votes again; and d) Only persons whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM.
- The manner of voting remotely for members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses is provided in the Notice of the AGM. The details will also be made available on the website of the Company www.creditaccessgrameen.in
- Shareholders who have not registered their email address and in consequence the Annual Report, Notice of e-AGM could not be serviced, may temporarily get their email address and mobile number registered with the Company's RTA, by following the instructions provided at https://ris.kfintech.com/email_registration/. In case of any queries, shareholder may write to inward.ris@kfintech.com.
- Shareholders may also visit the website of the company www.creditaccessgrameen.in or the website of the RTA evoting.kfintech.com for downloading the Annual Report and Notice of the e-AGM.
- Alternatively members may send an e-mail request at the email ID inward.ris@kfintech.com along with a scanned copy of the signed request letter providing the email address, mobile number, self-attested PAN copy and Client Master copy for sending the Annual Report, Notice of e-AGM and the remote e-voting instructions.

for CreditAccess Grameen Limited
 Sd/-
M. J. Mahadev Prakash
 Head - Compliance, Legal & Company Secretary
 Place: Bengaluru
 Date: July 07, 2021

ANUH PHARMA LIMITED
 CIN: L24290MH1960PLC011586
 Registered Office: 3-A Shivsagar Estate, North Wing, Dr. Annie Besant Road, Worli, Mumbai - 400 018 Phone: +91 22 66227575; Fax: +91 22 66227600; Email: anuh@sk1932.com; Website: www.anuhpharma.com

INFORMATION REGARDING 61TH ANNUAL GENERAL MEETING

- Notice is hereby given that the 61th Annual General Meeting (AGM) of the Members of ANUH PHARMA LTD. (Company) will be held on **Thursday, August 19, 2021 at 11:00 AM IST** through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with all the applicable circulars on the matter issued by Ministry of Corporate Affairs (MCA) and the Securities and Exchange Board of India (SEBI), to transact the business set out in the Notice calling the AGM.
- Availability of Annual Report:**
 Members may note that, in terms of applicable circulars of MCA and SEBI, the Annual Report of the Company for the financial year 2020-21 along with Notice convening the AGM will be sent only through email to all those members whose email addresses are registered with the Company or with their respective Depository Participant(s) (DP). The aforesaid documents will also be available on the website of the Company at www.anuhpharma.com and also on the website of stock exchange viz. www.bseindia.com
- Manner of Registration/Updating Email addresses:**
 Members holding shares in physical mode and who have not registered / updated their email addresses with the Company are requested to update their email addresses with the Registrar and Transfer Agents of the Company, viz. Bigshare Services Pvt. Ltd. on <https://bigshareonline.com/investorRegistration.aspx>. Members holding shares in dematerialized mode are requested to register / update their e-mail addresses with the respective DP.
- Manner of Casting Vote through E-voting:**
 Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and the applicable circulars of MCA and SEBI, the Company is providing facility of remote e-voting to its Members through Central Depository Services (India) Limited (CDSL). The instructions for attending the meeting through VC / OAVM and the manner of e-voting including remote e-voting by Members holding shares in dematerialized mode, physical mode and for Members who have not registered their email address has been provided in the Notice convening the AGM.
- Dividend:**
 Members may note that a Final Dividend of Rs. 1.50/- per share has been recommended by the Board of Directors of the Company for the financial year ended March 31, 2021, subject to the approval of the Members at the AGM. The Register of Members and Share Transfer Books of the Company will remain closed on August 19, 2021 for the purpose of payment of Final Dividend and AGM.
- Manner of registering mandate for receiving Dividend Electronically:**
 Members holding shares in physical form and who are yet to register / update their Bank Account details for electronic receipt of dividend amount directly into their bank accounts, are requested to get the same registered on <https://www.bigshareonline.com/InvestorRegistration.aspx>. Members holding shares in dematerialized mode are requested to get their Bank Account details registered / updated with their respective DP.

In case of any queries in registering / updating the e-mail address or bank account details such Members may write to investor@bigshareonline.com.

For Anuh Pharma Limited
 Sd/-
Bipin Shah
 Vice Chairman
 (DIN: 00083244)
 Date : July 07, 2021
 Place : Mumbai

BOI AXA Mutual Fund
 (Investment Manager: BOI AXA Investment Managers Private Limited)

Registered Office: B/204, Tower 1, Peninsula Corporate Park, Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai 400013
 CIN: U65900MH2007FTC173079

NOTICE-CUM-ADDENDUM NO. 6/2021-22
NOTICE-CUM-ADDENDUM TO THE SCHEME INFORMATION DOCUMENT ("SID"), AND KEY INFORMATION MEMORANDUM ("KIM") OF BOI AXA CREDIT RISK FUND:
Change in - Risk-o-meter of BOI AXA Credit Risk Fund ("the Scheme")

Notice is hereby given to the Unit holders of BOI AXA Credit Risk Fund, that pursuant to requirement of SEBI Circular No. SEBI/HO/IMD/DF3/CIR/P/2020/197 dated October 5, 2020 on the "Product Labelling in Mutual Fund Schemes - Risk-o-meter", the Risk-o-meter of BOI AXA Credit Risk Fund is revised as under:

<p>Risk-o-meter (Existing and basis portfolio of the Scheme as on May 31, 2021)</p> <p>Investors understand that their principal will be at very high risk</p> <p>*Investors should consult their financial advisers if in doubt about whether the product is suitable for them.</p>	<p>Revised Risk-o-meter (Revised and basis portfolio of the Scheme as on June 30, 2021)</p> <p>Investors understand that their principal will be at high risk</p> <p>*Investors should consult their financial advisers if in doubt about whether the product is suitable for them.</p>
---	--

Investors are also requested to note that apart from the change in the Risk-o-meter as stated above, there is no other change in the scheme features of BOI AXA Credit Risk Fund.

This Notice-cum-Addendum forms an integral part of the SID and KIM of BOI AXA Credit Risk Fund. All other terms and conditions as mentioned in SID & KIM shall remain unchanged.

For BOI AXA Investment Managers Private Limited
 (Investment Manager for BOI AXA Mutual Fund)
 Sd/-
Authorised Signatory

Place : Mumbai
 Date : July 07, 2021

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

